

જુલાઈ 30, 2018

સીટી ઓફ બ્રામ્પટનમાં સિવિક હોલીડે (નાગરિકો માટેની જાહેર રજા)

બ્રામ્પટન સીટી હોલ સોમવાર, ઓગસ્ટ 6 નાં રોજ સિવિક હોલીડે દરમિયાન બંધ રહેશે. શહેરની સંખ્યાબંધ સેવાઓ અનુપલબ્ધ રહેશે અથવા ઘટાડેલા સેવા સ્તરો સાથે કાર્યરત રહેશે. રહેવાસીઓ આ સમય દરમિયાન રૂબરૂમાં મેરેજ લાયસન્સીસ મેળવવા અરજી કરી શકશે નહિ, પાર્કિંગ દંડ ચૂકવી શકશે નહિ, અથવા પરમીટ્સ મેળવવા અરજી કરી શકશે નહીં. ઓનલાઈન વિકલ્પો માટે કૃપા કરી વેબસાઈટ જુઓ,

www.brampton.ca

સંખ્યાબંધ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેવાનું ચાલુ રહેશે, જેમાં સામેલ છે: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ (અગ્નિશમન અને કટોકટી સેવાઓ) અને બાય-લો એન્ફોર્સમેન્ટ. બ્રામ્પટન શહેર સેવામાં તમામ ફેરફારો અને સેવા બંધ રહેવાને લગતી વધુ માહિતી માટે, કૃપા કરી 311 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઈટ જુઓ, www.brampton.ca

બ્રામ્પટન ટ્રાન્ઝિટ જાહેર રજા અઠવાડિક રજાનું સમયપત્રક (સિવિક હોલીડે વીકએન્ડ સ્કેડ્યુલ):

- શુક્રવાર, ઓગસ્ટ 3: અઠવાડિક દિવસની નિયમિત સેવા
- શનિવાર, ઓગસ્ટ 4: શનિવારની નિયમિત સેવા
- રવિવાર, ઓગસ્ટ 5: રવિવારની નિયમિત સેવા
- સોમવાર, ઓગસ્ટ 6: રવિવાર/રજાના દિવસની સેવા

ટ્રાન્ઝિટ સ્ટોર્સ સોમવાર, ઓગસ્ટ 6 નાં રોજ બંધ રહેશે.

માર્ગ અને સમયપત્રક (રૂટ અને સ્કેડ્યુલ) માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કરો અથવા વેબસાઈટ www.bramptontransit.com જુઓ અથવા રિયલ-ટાઈમ (વાસ્તવિક સમયે) તમારા મોબાઈલ સાધન વડે બસ માહિતી મેળવવા www.nextride.brampton.ca જુઓ.

પાર્ક્સ (ઉદ્યાનો) અને રિક્લિએશન (મનોરંજન)

મોટા ભાગની મનોરંજન સગવડો સિવિક હોલીડે વીકએન્ડ દરમિયાન ખુલ્લી રહે છે. કૃપા કરી તમારા સ્થાનિક મનોરંજન કેન્દ્રને (રિક્લિએશન સેન્ટરને) ફોન કોલ કરો, 311 નંબર પર કોલ કરો અથવા વેબસાઈટ www.brampton.ca જોઈને કાર્યક્રમનું સમયપત્રક પાકું કરો.

આ શહેરની રિક્લિએશન એડમિનિસ્ટ્રેશન ઓફિસ સોમવાર, ઓગસ્ટ 6 નાં રોજ બંધ રહેશે.

બ્રામ્પટન લાઈબ્રેરી

બ્રામ્પટનની તમામ પુસ્તકાલય શાખાઓ (સિવિક સેન્ટરમાં ચિંગકુસી, સીરિલ ક્લાર્ક, ફોર કોર્નેર્સ, ગોર મેડોસ, માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ, સિંગ્રાડેલ અને સાઉથ ફ્લેચર્સ) સોમવાર, ઓગસ્ટ 6 નાં રોજ બંધ રહેશે.

વધુ માહિતી મેળવવા, 905.793.4636 અથવા 311 નંબર પર ફોન કોલ કરો, અથવા વેબસાઈટ જુઓ www.bramptonlibrary.ca

આતશબાજી સુરક્ષા

નાગરિક જાહેર રજા પર સીટી ઓફ બ્રામ્પટન દ્વારા આયોજીત આતશબાજી કરવામાં આવતી નથી.

આ શહેરની જાહેર રજા વર્ષ દરમિયાનના એ ચાર દિવસો પૈકી એક નથી જ્યારે સીટી ઓફ બ્રામ્પટનમાં અંગત આતશબાજી કરવાની છૂટ આપવામાં આવતી હોય. વધુ માહિતી માટે, 311 નંબર પર ફોન કરો અથવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/bylaws

-30-